# **ASHNISHA INDUSTRIES LIMITED**

February 06, 2024

To,
Department of Corporate Services
BSE Limited
Ground Floor, P. J. Tower,
Dalal Street, Fort,
Mumbai - 400 001

Security ID: <u>ASHNI</u> Security Code: <u>541702</u>

Sub: Copy of Advertisement of notice of Extra-Ordinary General Meeting and e-voting information.

Dear Sir/Madam,

Please find enclosed herewith copy of Advertisement of notice of Extra Ordinary General Meeting to be held on Friday, 1st March, 2024 at 03:30 PM through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") and e-voting information, published in one English daily newspaper and one daily newspaper in the language of the region, where the registered office of the company is situated.

Please take the same on your record.

Thanking You,

Yours faithfully, For Ashnisha Industries Limited

Ashok C. Shah Managing Director DIN: 02467830

Encl: As above



# Figure it out

"We see an extraordinary success story. And we see the remarkable achievements under Prime Minister Modi's watch that have materially benefitted so many Indian lives," said the US secretary of state, Antony Blinken, at Davos to the journalist, Thomas Friedman, a self-declared "raging Indiaphile".

Was starry-eyed Blinken referencing India's rising contribution to illegal immigration in the United States of America? Indian illegal immigrants fleeing joblessness could soon exceed the receding numbers from Mexico. Perhaps Blinken was referring to reports of 7% GDP growth rates. He should know

India's recent growth spurt is a 'dead-cat bounce' post its devastating Covid phase. In the entire post-2019 period since the onset of Covid, combining the initial, steep decline with the subsequent recovery, India's GDP growth averages a modest annual 3.5% rate. Using such multi-year averages is crucial to avoid cherry-picking selective data. India's celebrated exceptionalism disappears in the clearer vision of averaged numbers. Its post-Covid growth has been lower than that in Bangladesh, Vietnam, and even China amid its extensive economic correction.

demonetisation to about 5% following demonetisation and the bursting of an unsustainable credit bubble. And the further fall since then to the 3.5% post-Covid rate is despite being propped up by another credit bubble. The new bubble is corrosive. The government tops up the capital of public sector banks suffering from defaults by big business and banks and 'fintechs' push loans on consumers. Fintech loans are often at usurious rates and quickly become unrepayable, causing great stress. Pursuit of mobile loan app defaults by recovery agents have triggered dismissal from jobs, even suicides. Meanwhile, manufacturing growth — the only mass source of dignified jobs — was anaemic even at its high of 1.6% a year; it is now down to 0.8% a year.

Nor are matters improving. Indian business elites talk Modi up but fail to match their words with action. Private investment in machinery and structures (as a share of GDP) continues to decline, a sure sign that Indian investors see the future darkly. Investors have reasons to worry. Their investment has become steadily less productive: a rupee of investment generates ever-smaller increases in GDP.

# India's ascendant narrative takes centre stage globally

wield significant influence, India is crafting its own story on the global stage, reflecting its rich heritage and unique position. Despite facing scrutiny, comparisons to historical precedents, and criticisms in Western media, India's trajectory is distinct and should not be analogized with outdated references. India stands out as a prime example of economic growth, outpacing even developed economies. Recent data from the World Bank reveals an impressive 7.2 per cent growth rate during the fiscal year 2022-23, positioning India as the secondhighest among G20 countries. This growth, nearly double the average of emerging market economies, showcases India's resilience and economic prowess. While Western media tends to juxtapose India's successes with persisting challenges, such as poverty, it is crucial to recognise

Like us on: f facebook.com/WesternR

In an era where narratives that poverty is a global issue cutting across both developing and developed nations.

#### **WESTERN RAILWAY - VADODARA DIVISION GATI SHAKTI DEPARTMENT** CONSTRUCTION OF ROAD OVER BRIDG e-TENDER NOTICE NO.

CPM-GSENGG-BRC-12-2023-24 ealed Tenders for and on behalf of the Sealed lenders for and on behalf of the President of India are invited by Chief Project Manager (Gati Shakti), Western Railway, Pratapnagar, Vadodara-390 004 for the following works. i) E-Tender No. CPM-GS-ENGG-BRC-12-2023-2024 ii) Name of Work: Vadodara Division Construction of Road Over Bridge (ROB) ncluding approaches in lieu of LC No. 295 at Km. 474/2-4 on Vadodara-Geratpu section. iii) Approximate Cost of work (in Rs.): ₹ 45,85,11,217.00 (Rupees Forty Five corors, Eighty Five Lakhs, Eleven thousand Two Hundred Seventeen Only) iv) Earnest Money to be deposit (in Rs.): ₹ 24,42,600/- (Rupees Twenty Four Lakhs ₹ 24,42,600/- (Rupees Twenty Four Lakhs Forty Two Thousands Six Hundred only) v) Availability of online Tender for bidding: From 19-02-2024 at 11:00 Hrs. to 04-03-2024 up to 15:00 Hrs. Opening of Technical Bid Date and time: 04-03-2024 at 15:30 Hrs. vi) Regarding detailed notice containing cost of tender document (non refundable), EMD, eligibility criteria, Similar Nature of work, detailed tender Similar Nature of work, detailed tender conditions, please visit www.ireps.gov.ii
Manual offers will not be considered

**WESTERN RAILWAY - VADODARA DIVISION** 

Raikot-360001

**CATERING STALL CONTRACT** Auction Catalogue No. CATERING-BRC-02

	Catering Stall Contract - www.ireps.gov.in								
	Auction Start Date - 19-02-2024 at 10:00 hrs Auction Close date - 19-02-2024 at 14:30 hrs Contract Period : 05 Years								
Sr. No.	Station	Lot No./Category	Location						
1.	Nandesari	Catg-BRC-NDR-GMU-17 22-1 (Catering-General Minor Unit (GMU)	Near stairs to PF-ADI side						
2.	Palej	Catg-BRC-PLJ-SMU-7-22-1 (Catering-Special Minor Unit (SMU)	Between Water Fountain & OHE KM 350/31						
3.	Itola	Catg-BRC-ITA-GMU-11-22-1 (Catering-General Minor Unit (GMU)	Under cover shed in front of Booking Office BRC side						
4.	Nabipur	Catg-BRC-NIU-SMU-6-22-1 (Catering-Special Minor Unit (SMU)	Under cover shed, in front of SS & Booking office, BCT side.						
5.	Vishwamitri	Catg-BRC-VS-GMU-12-22-1 (Catering-General Minor Unit (GMU)	In front of SM Office in cover Shed Nr. Water fountain towards BRC side.						
6.	Vishwamitri	Catg-BRC-VS-GMU-13-22-1 (Catering-General Minor Unit(GMU)	Near OHE Km 392/27						
7.	Kosamba	Catg-BRC-KSB-SMU-4-22-1 (Catering-Special Minor Unit(SMU)	Between Pillar 3/4						
8.	Kim	Catg-BRC-KIM-GMU-3-22-1 (Catenng-Gencral Minor Unit(GMU)	Between Pillar 8 & 9						
9.	Utran	Catg-BRC-URN-SMU-1-22-1 (Catering-Special Minor Unit(SMU)	Between Shed Pillar No. 5 & 7						
10.	Panoli	Catg-BRC-PAO-SMU-5-22-1 (Catering-Special Minor Unit(SMU)	Between OHE KM 306/5 & 306-3						
11.	Kosad	Catg-BRC-KSE-SMU-2-22-1 (Catering-Special Minor Unit(SMU)	In front of old station Building						
12.	Petlad	Catg-BRC-PTD-GMU-23-22-1 (Catering-General Minor Unit(GMU)	Near Booking Office Under Cover shed						
13.	Khambhat	Catg-BRC-CBY-GMU-24-22-1 (Catering-General Minor Unit(GMU)	Between SS office & Water Cooler						
14.	Umreth	Catg-BRC-UMH-SMU-25-22-1 (Catering-Special Minor Unit(SMU)	Near FOB, Anand Side						
15.	Derol	Catg-BRC-DRL-SMU-16-22-1 (Catering-Special Minor Unit(SMU)	Near Water Fountain						
16.	Dabhoi	Catg-BRC-DB-SMU-15-22-1 (Catering-Special Minor Unit(SMU)	Near Under Ground ramp PRTN Side						
17.	Chhota Udepur	Catg-BRC-CTD-GMU-29-22-1 (Catering-General Minor Unit(GMU)	Towards Vadodara Side after Offices						
18.	Alirajpur	Catg-BRC-ARPR-SMU-30-22-1 (Catering-Special Minor Unit(SMU)	Near Dy SS Office & Waterhut						
19.	Pavi	Catg-BRC-PAVI-SMU-28-22-1 (Catering-Special Minor Unit(SMU)	Near Waiting Hall						
20.	Bodeli	Catg-BRC-BDE-GMU-27-22-1 (Catering-General Minor Unit(GMU)	Near Pump house						
21.	Gothaj	Catg-BRC-GTE-SMU-18-22-1 (Catering-Special Minor Unit(SMU)	Near Pole No. 458/33						
22.	Mahemdavad	Catg-BRC-MHD-SMU-19-22-1 (Catering-Special Minor Unit(SMU)	Near OHE Km 467/12 in Cover shed						
23.	Nenpur	Catg-BRC-NEP-SMU-20-22-1 (Catering-Special Minor Unit(SMU)	Near Pole No. 471/8						
24.	Kanij	Catg-BRC-KANJ-SMU-21-22-1 (Catering-Special Minor Unit(SMU)	Near Pole No. 474/14						
25.	Geratpur	Catg-BRC-GER-GMU-22-22-1 (Catering-General Minor Unit(GMU)	Near Pole 482/4						

Like us on: f facebook.com/WesternRly • Follow us on: twitter.com/WesternRly

# Jawan moves Gujarat HC for action over disclosure of HIV+ status

Gujarát high court seeking an mitted without his consent. inquiry and action against his superior officials after his HIV positive status was disclosed circulated on a WhatsApp group. This happened in October, on a social media group for personnel deployed at a vital industrial installation in South Gujarat. The document shared on the group contained the health statuses of all personnel. The petitioner was shown to be HIV positive. This offended him and he made complaints and several representations to the higher-ups in

Industrial Security Force action for the disclosure of his (CISF) jawan has moved the health status, which is not per-

When the jawan did not get a response, he filed a petition in the high court through in an official communication, advocate Bhavik Samani, demanding an inquiry into the lapse and action against the erring officers. It was contended that the document was signed by his commandant.

There was another serviceman on the group with HIV positive status, but for him the accepted acronym was used — PLWH on ART (People living with HIV on antiretroviral therapy). This should have been used for the petitioner

#### WESTERN RAILWAY - AHMEDABAD DIVISION

**E-AUCTION FOR LEASING OUT OF PARCEL SPACE** With reference to above, Bids are invited on E-auction for leasing out of Parcel Space in Passenger Carrying Trains, originating from Ahmedabad Division for following catalogue, which has been already published on IREPS website. The details are

Catalogue No.	Type of Contract	Category	Date & Time of e-Auction			
ADI-Lease- 16-24	Parcel		E-Auction for the lot will start at 11:00 Hrs. on date 16-02-2024			
Note: Prospective bidders are requested to visit e-Auction Leasing module on IREPS						

website (www.ireps.gov.in) The Lot-wise details are available therein under above mentioned Catalogue No. Initial Cooling Off period is 30 minutes. Successive Lot Closing Interval is 10 minutes

Lot-wise Closing Time can be viewed in e-Auction module of IREPS. Like us on: f facebook.com/WesternRly • Follow us on: x twitter.com/WesternRly

#### SHRIRAM HOUSING FINANCE LIMITED Reg.Off.: Office No.123, Angappa Naicken Street, Chennai-60000

SHRIR M Head Office: Level 1, Wockhardt Towers, East Wing, C-2, G Block, Bandra-Kurla Complex, Mumbai 400 051

#### Website: www.shriramhousing.in **SYMBOLIC POSSESSION NOTICE**

Whereas. The undersigned being the authorised officer of Shriram Housing Finance Limited (SHFL) under the provisions of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (said Act) and in exercise of powers conferred under Section 13(12) of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 (said Rules) issued demand notices to the Borrowers details of which are mentioned in the table below to repay the amount mentioned in the said demand

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken SYMBOLIC POSSESSION of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with rule 8 of

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of Shriram Housing Finance Ltd. for an amount as mentioned herein

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13

section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.					
Borrower's Name & Address	Amount due as per Demand Notice				
1. Jagdishbhai Mohanlal Bholani, 2. Shardaben Bholani Jagdishbhai Present Address :- Nandan Park-1, Behind Rameshwar, Jamnagar-361008	Rs.9,21,991/- (Rupees Nine Lacs Twenty One Thousand Nine Hundred Ninety One Only) as on 06- Nov-23 under reference of Loan				
Also Permanent Address :- Patel Vadi, Nava-gam ghed, Dangarvada, Kalavad, Jamnagar- 361008	Account No. SBTHJMNG0000154 and Rs.4,74,627/- (Rupees Four Lacs Seventy Four Thousand Six Hundred Twenty Seven Only Only)				
Also Business Address :- Mohanlal Hiranand, Station Road, K.No.194 Jamnagar-361001	as on 06-Nov-23 under reference of Loan Account No. STUHJMNG0000178 with further interest and other costs,				
Also Property Address :- Sub-Plot No.4/6, Nandan Park-1, Near Jalaram Nagar, Off.Bedi Bundar Road, Navagam	charges and expenses within 60 days from the date of receipt of the said notice.				
Ghed, Jamnagar-361008  Description of	13(2) Notice Date.16/11/2023  Property				

In Jamnagar City within the limits of Jamnagar Municipal Corporation in the area of Navagam Ghed Originally the land of R.S.No.239/1, total admeasuring 8021.00 sq.mtrs Jamnagar Municipal Corporation have sanctioned the lay-out plan and collector Jamnagar has converted into non-agriculture land for residential purpose and as per layout plan this land divided into 1 to 62 residential plots-361008, Out of these plots, plot no.4 to 19 were amalgamated and given new plot no.4 and new plot no.4 was sub plotted into 18 different sub plot no.4/1 to 4/18 by the approval of Jamnagar Municipal Corporation.

Out of these plots alongwith construction Sub-Plot No.4/6 admeasuring plot area 44.24 sq.mtrs, together with construction

All that piece and parcel of Row House admeasuring the Land area as 44.24 sq.mtrs and the Super Built up area as 57.69 sq.mtrs situated at Final Plot No.4/6. Survey No.R.Sr.no.239/1, Block/Building No.4/6, House No.4/6, Building/Society Name-Nandan Park, Street Name.Riddhi Society, Area-Rameshwar Nagar, City-Navagam Ghed, Jamnagar owned by Smt.Shardaben Jagdish Bholani alongwith construction and bounded of the property is as under:- North: Sub Plot No.4/7, South: Sub Plot No.4/5, East: 7.5 mtrs wide Road, West: Plot No.39 & 40

Borrower's Name & Address	Amount due as per Demand Notice
1. Jitendra Jentibhai Rathod 2. Rathod Nirmalaben Jentibhai Present Address: - Dhanlaxmi Shraddha Society, Street No.2, Sadhuvasvani Road, Behind Popatpara, Railnagar, Nr.Parivar mart, Rajkot- 360001 Also: - Jitendra Jentibhai Rathod Business Address: - Prajapti Mineral Water,Dhanlaxmi Shraddha Society, Street No.2, Sadhuvasvani Road, Behind Popatpara, Railnagar, Nr.Parivar mart, Rajkot-360001 Also Property Address: - Flat No.201, Ashopalav Residency, 2nd floor, Building No.A, Opp. Gulmohar Plaza, Near Petrol Pump, 80 FT Road, Railnagar,	Rs.18,06,391/-(Rupees Eighteen Lakh Six Thousand Three Hundred Ninety One Only) as on 06/11/2023 under reference of Loan Account No. SHLHRAJK0001311 with further interest and other costs, charges and expenses within 60 days from the date of receipt of the said notice.
· ····································	I TO (2) NOTICE

## **Description of Property**

A Residential Flat No.201, having built up area Sq.Mt.57-50 on 2nd Floor in building known as "Asopalav Residency-A,", on land admeasuring, Total sq.mt 2875-00 of Plot No.1 and common plot of Revenue Survey No.598 paiki 4, Final Plot No.14/2, of T.P.S.No.23 of Rajkot. Boundaries of the property: - East :- Flat No.202, West :-Garden, North: Covered Parking, South: Passage then after Flat No.204

Date.16/11/2023

Place: Raikot & Jamnagar Sd/- Authorised Officer Date: 03-02-2024 Shriram Housing Finance Limited as well. Justice V D Nanavati issued notice to the Centre, the director general of the CISF and the commandant concerned, seeking their replies in two weeks.

Disclosure of an HIV positive patient's identity is prohibited by the HIV and AIDS (Preventión & Control) Act, 2017. Any violation entails punishment with a jail term lasting between three months and two years, and a fine of up to Rs 1 lakh. A CISF jawan has been suspended for dereliction of duty after a security breach at Delhi airport, where a 22year-old intoxicated man scaled the perimeter wall and reached the taxiway. The intruder was spotted by a pilot and later arrested, leading to an inquiry. The man's entry was unauthorized, and he was found to be a smack addict.

Former military nursing officers demand ex-servicemen status; Ex MNS Officers Welfare Association addresses media; Government's double standards on women empowerment; MNS officers denied ex-servicemen status; Stripped of reemployment opportunities Karaivetti Bird Sanctuary and Longwood Shola Reserve Forest in Tamil Nadu join 3 other Ramsar wetlands in Karnataka as new additions to the 80 Ramsar sites in India.

## **WESTERN RAILWAY - AHMEDABAD DIVISION**

## **CORRIGENDUM**

The date of opening of tender TENDER NOs. DRM-ADI-159, 160 & 163-2023-24 of NIT NO. 35 of 2023-2024 dated 18-01-2024 may be read a 20.02.2024 instead of date 13.02.2024. The details are as under : Tender Nos DRM-ADI-159, 160 & 163-2023-24-2023-24. Date of Opening: 20-02-2024 All other terms and conditions of above ender Notice remain unchanged. ADI-20

Follow us on: X twitter.com/WesternRly

#### NOTICE REGARDING LOST SALE DEED Whereas Bliss Commercial Private

Limited is the lawful owner of the non-agricultural land bearing No.535/2/2/3/1 Survey admeasuring 2,520 sq.mtrs situated at Village Sayli, Silvassa in the union Territory of Dadra and Nagar Haveli (the "Land"). Notice is hereby given that a Sale Deed dated 18th July 2000 entered between M/s. Ajay Enterprises and Rliss Commercial Private Limited vide which Bliss Commercial Private Limited had purchased the above said Land from Ajay Enterprises and which was Registrar of Dadra and Nagar Haveli, Silvassa at Serial No.1180 2000 on 19th July 2000 was kept at the registered office of the company at 401. Jhulelal. 16th Road, Khar (W), Mumbai-400052 and the said original sale deed has been lost and is not traceable and a complaint regarding the same has been lodged with the Khar Police Station under Lost Report No 15675-2024 on 2nd February, 2024 If the original Sale Deed referred to above is found then please return at Bliss Commercial Private imited, 401, Jhulelal, 16th Road Khar (W). Mumbai-400052 within 3 days from publication of this Date: 06/02/2024

**SMFG** Grihashakti

### **SMFG India Home Finance Company Ltd.**

(Formerly Fullerton India Home Finance Co. Ltd.) Corporate Off.: 503 & 504, 5° Floor, G-Block, Insipre BKC, BKC Main Road, Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400051
Regd. Off.: Megh Towers, 3rd Floor, Old No. 307, New No. 165, Poonamallee High Road Maduravoyal, Chennai - 600 095

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES E-AUCTION SALE NOTICE OF 30 DAYS FOR SALE OF IMMOVABLE ASSETS UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 READ WITH PROVISION TO RULE 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002.

otice is hereby given to the Public in General and in particular to the Borrower(s) and Guarantor(s) that the below list movable properties ("Secured Assets") mortgaged / charged to the Secured Creditor, the Possession of which has bee imovable properties ( secured Assets ) montgaged of relarged to the Secured Creditor, the Fossession of which has been taken by the Authorised Officer of SMFG India Home Finance Company Ltd. (Formerly Fullerton India Home Finance Co. Ltd.) (hereinafter referred to as SMHFC) ("Secured Creditor"), will be sold on "As is where is", "As is that is" and "Whatever there is" on the date and time mentioned herein below, for recovery of the dues mentioned herein elow and further interest and other expenses thereon till date of realization, due to SMHFC Secured Creditor from the orrower(s) and Guarantor(s) mentioned herein below.

ne Reserve Price, Earnest Money Deposit (EMD) and Last Date of EMD deposit is also mentioned herein below: 1) Date & Time of E-Auction: 07.03.2024 at 11.00 AM to 01.00 PM (with unlimited extension of 5 minute each)

2) L	ast Date & Time of Submission of Re	equest Lette	r of Participate/K	YC Documents/Pi	roof of EMD, etc. : 06.03.2024	
SI. No.	Name of the Rorrower(s) / Guarant	tor(s) LAN	Demand Notice Date & Amount		Description of the Properties	
1.	Lan No. 600239211071267 (1) Anil Kumar Mourya, S/o. Babu (2) Kusuma Devi Add.: (Sr. No. 1, 2) Block No. No. 06, Vishakarma Nagar, Pipo Pipodara Surat, Nr. Goldi Sol Gujarat - 394110. Also at (Sr. No. 212, Pratishtha Park, Vibhag-2 Residency, Opp. Tapovan Scho Mulad Road, Mulad, Olpad, Surat	148, Shop odara Gidc lar, Surat, <b>No. 1)</b> Plot 2, Nr. Kavya pol, Kim - - 394110.	15,16,983/- (Rs. Fifteen Lakh Sixteen Thousand Nine Hundred EightyThree Only) due as on 17.07.2023	Block No. 299/A/ Along With 35.2 Road & Open I Block No. 291, F & Block No. 289 207/2+193,194 Sq.Mts. Durasti Bounded As:- 205, North: Plo	aring Plot No. 212 (As Per K. J. 174/212)Total Admeasuring 66 3 Sq. Mts. Undivided Share I. and, In "Pratishtha Park Part-Revenue Survey No. 195/1+2 F. & Revenue Survey No. 201, &214/2 Admeasuring 31363 SPatrak No. 57 & 58, Block No. 8, of Moje Village Mulad, Ta. Olg. East: Society Internal Road, tho. 211, South: Plot No. 213	.97 Sq.Meters, n The Land of 2 " Situated At Paiki 196 +200, 195/1+2 Paiki, q.mts & 61616 289/A & 289/B pad, Dist. Surat <b>West</b> : Plot No.
	Reserve Price: Rs.15,90,000/- Earnest Money Deposit: Rs.1,59,000/- Bid Incremental Value: Rs.15,900/-					

		<b>Money Deposi</b> Ipees One Lakh Thousand C					
SI. No.	Name of the Borrower(s) / Guara	ntor(s) LAN	Demand Notice Date & Amount		Description of the Properties		
2.	Lan No. 600238011040942 (1) Phoolchand Ramlaxman, S/o. Ramlaxman, (2) Kanchan Phoolchandra Ve Add.: (Sr. No. 1, 2 ) Block Vishvakarma Nagar, Pipoda Pipodara, Nr. Federal Bank, Sur - 394110. Also at (Sr. No. 1) Pi Pratishtha Park, Vibhag-2, Residency, Opp. Tapovan Sch Mulad Road, Mulad, Olpad, Sura	No. 148, ara Gidc, rat, Gujarat ot No. 203, Nr. Kavya, ool, Kim -	Thousand Two Hundred EightyFive Only)due as on	No. 289/A/165/203 57.07 Sq.yard., Alc Land of Road & Or At Block No. 291, I & Block No. 289 & + 193,194 & 214/2 Durasti Patrak No. 291/B, of Moje Vill	ing Plot No. 203 (As Per K. J. P. Record Block Admeasuring 47.72 Sq.Mts.) Admeasuring in With 25.11 Sq. Mts. Undivided Share In The ben Land, In "Pratishtha Park Part-2" Situated Revenue Survey No. 195/1+2 Paiki 196 + 200, Revenue Survey No. 201,195/1+2 Paiki, 207/2 Admeasuring 31363 Sq.Mts. & 61616 Sq.Mts. 57 & 58, Block No. 289/A & 289/B & 291/A age Mulad, Ta. Olpad, Dist. Surat, Bounded Io. 214, West: Society Internal Road, North: h: Plot No. 202.		
		Money Deposi bees One Lakh		Bid Incremental Value: Rs.12,200/- (Rupees Twelve Thousand Two			

Details terms and conditions of the sale are as below and the details are also provided in our/secured creditor's website at the llowing link website address (https://disposalhub.com and https://www.grihashakti.com/pdf/E-Auction.pdf) The Intendin idders can also contact Abhishek Awasthi, on his Mob. No. 9825097367, E-mail : Abhishek.Awasthi@grihashakti.com an ushil Patil, on his Mob. 8828888998, E-mail : Sushil.Patil1@Grihashakti.con

Date: 06.02.2024

Authorized Officer, SMFG INDIA HOME FINANCE COMPANY LIMITED (Formerly Fullerton India Home Finance Co. Ltd.)

## ASHNISHA INDUSTRIES LIMITED

CIN- L74110GJ2009PLC057629 Regd. Office: 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mithakhali Six Roads, Ahmedabad-380006. **Phone No.:** 079-26463227.

E-mail ID: ashnishalimited@gmail.com Website: www.ashnisha.in

NOTICE is hereby given that the Extra Ordinary General Meeting (EOGM/EGM) of the members of the Company will be held on Friday, 1st March, 2024 at 3:30 P.M. IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the notice of EGM in compliance with General Circular Nos. 14/2020 (dated 8th April, 2020), 17/2020 (dated 13th April, 2020), 20/2021 (dated 5th May, 2020), 02/2021 (dated January 13, 2021), 10/2021 (dated June 23, (021), Circular No. 20/2021 (dated December 08, 2021) and Circular No. 11/2022 (dated December 28, 2022) respectively, issued by the Ministry of Corporate Affairs ("MCA Circular(s)") and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May 2020, Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021, Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P 2022/62 dated 13th May, 2022 and Circular No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated 5th January, 2023 issued by the Securities and Exchange Board of India ("SEBI Circulars").

In compliance with MCA Circulars and SEBI Circulars, the Notice of EGM has been sent in electronic mode only to all those

embers whose e-mail Ids are registered with the Company or the Registrar and Share Transfer Agent or their respectiv

REMOTE E-VOTING:

n compliance with provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing its members, the facility to exercise their right to vote at the Extra Ordinary General Meeting (EGM) by electronic means on all the businesses set forth in the Notice of the EGM through the remote e-Voting Services provided by CDSL. The detailed instructions for remote e-voting facility are contained in the Notice of the EGM which has been sent to the Members.
The details pursuant to the provisions of Companies Act, 2013 and Rules are given hereunder:

Cut-off date for the purpose of remote e-voting is Friday, 23rd February, 2024.

Period of e-voting: E-voting shall commence from Tuesday, 27th February, 2024 at 9:00 A.M. and ends on Thursday, 29th

February, 2024 at 5:00 P.M. Please note that remote e-voting will not be allowed beyond the above mentioned time and date Persons who have acquired shares and become member of the Company after dispatch of Notice of the EGM and holding shares as on the cut-off date i.e. 23rd February, 2024, may cast their votes by following the instructions and process o remote e-voting as provided in the Notice of EGM.

Notice of EGM is available on website of the Company (www.ashnisha.in) as well as website of CDSL (www.evotingindia.com)
A person, whose name appears in the Register of Members or in the Register of Beneficial owners maintained by the depositories as on cut-off date only, shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the EGM. However, if the person is already registered with CDSL for remote e-voting, then the existing User ID and Password can be

Members attending EGM through VC/OAVM facility, who have not casted their votes by remote e-voting shall be able to cast their votes through e-voting at the EGM. Members who have casted their votes by remote e-voting, may also attend the EGM through VC/OAVM facility but shall

not be entitled to cast their votes again at the EGM.
The procedure for e-voting, attending the EGM through VC/OAVM facility and registration of shareholders has been provided in the Notice of EGM. The same is available on the website of the Company: www ashnisha.in, website of Central Depository Services India Ltd. at www.evotingindia.com and at the website of BSE Limited

If you have any queries or issues regarding attending EGM & e-voting from the CDSL e-Voting System, you can write an email to helpdesk.evoting@cdslindia.com or contact at toll free no. 1800 22 55 33.

Ohr All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Sr. Managei

(CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mil Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com o call toll free no. 1800 22 55 33.

For, Ashnisha Industries Limited By order of Board

Ashok Shah

Managing Director DIN: 02467830

Place: Ahmedabad Date: 05-02-2024

## YASH CHEMEX LIMITED

411.4TH FLOOR.SIGMA ICON-1.OPP. MEDILINK HOSPITAL SATELITE.AHMEDABAD-380015

TELE:- 079-40028639, Email:- yashchem@hotmail.com, Website: - www.vashchemex.com

CIN:- L74110GJ2006PLC048385

Statement of Standalone and Consolidated Unaudited Financial Results for the Quarter and Nine Months Ended December 31.2023

									(KS. IN IAKNS
		Stan	dalone Unudite	ed Financial Re	sults	Conso	idated Unaudi	ted Financial R	esults
	Particulars	Quarter Ended 31/12/2023	Quarter Ended 30/09/2023	Quarter Ended 31/12/2022	Year Ended 31/03/2023	Quarter Ended 31/12/2023	Quarter Ended 30/09/2023	Quarter Ended 31/12/2022	Year Ended 31/03/2023
1	Total Income from Operations	1,690.37	1,311.50	2,895.50	5,632.90	1,901.08	1,939.22	2,173.50	9,141.91
	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	21.02	46.30	(7.68)	50.87	55.23	193.32	43.45	472.27
	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	21.02	46.30	(7.68)	50.87	55.23	193.32	43.45	472.27
	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	24.57	33.17	(6.10)	38.82	52.35	151.10	34.30	381.59
	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]		48.98	(23.34)	113.98	78.53	166.91	65.98	457.07
	Equity Share Capital of Face Value Rs.10/- Each	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34
	Earnings Per Share (of Rs. 10/- Each) (for continuing & discountued operatoions):								
1	A: Basic	0.24	0.32	(0.06)	0.38	0.38	0.73	(2.56)	2.73
l	B: Diluted	0.24	0.32	(0.06)	0.38	0.38	0.73	(2.56)	2.73
NOTES:				/					

the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Result are available on the Stock Exchange website i.e. www.bseindia.com and www.nseindia.com and on the website of the Comapny i.e. www.yashchemex.com

he above unaudited Standalone and Consolidated Financial Results for the Quarter and Nine months ended December 31,2023 have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors in their respective meetings held on February 05, 2024. The Review as required under Regulation 33 of th SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the statutory auditor of the company and the related report is ubmitted to the concerned stock exchanges.

The unaudited Standalone and Consolidated Financial Results for the Quarter and Nine months ended December 31,2023 have been prepared in accordance with the policies to the extent applicable.

By Order of Board of Directors

Pritesh Shah Managing Director DIN: 00239665

Place: Ahmedabad Date: February 05, 2024

# तंत्रीश्रीनी इसमे

# ઈટલી પર આર્થિક સંકટ. ર લાખ કરોડનું દેવું!

જ્યોર્જિયા મેલોનીની આગેવાની હેઠળનો દેશ ઈટલી આજે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. મેલોનીનું ઈટલી ૨ અબજ યુરો એટલે કે ૨ લાખ કરોડનું દેવું છે. તેને દૂર કરવા માટે પીએમ મેલોની પોતાના દેશની વિરાસત વેચવા જઈ રહી છે. પીએમ મેલોનીએ ટપાલ સેવાનો કેટલોક હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે આ એ જ ટપાલ સેવા છે જેને એક સમયે વડાપ્રધાન પોતાના દેશનું તાજ રત્ન માનતા હતા. કારણ કે તે ઇટલીનો વારસો છે, જે ખૂબ જ કિંમતી છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મેલોની દેશની ટપાલ સેવાની હરાજી કરીને વર્ષ ૨૦૨૬ સુધીમાં લગભગ ૧.૭૯ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે. તમને જણાવી દઈએ કે ઈટાલીની પોસ્ટલ સર્વિસ (પોસ્ટે ઈટાલિયન) રેલ કંપની ફેરોવી ડેલો સ્ટેટો અને પાવર કંપની એનઆઈમાં હિસ્સો ધરાવે છે. આ સિવાય તેઓ ઈન્સ્યોરન્સ અને બેંકિંગના કામમાં પણ જોડાયેલા છે. સરકારની આવકનો મોટો હિસ્સો આમાંથી જ આવે છે. પરંતુ હાલના દિવસોમાં ખોટમાં ચાલી રહેલી સરકારને આ મોટું સાહસ ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જોકે, નિષ્ણાતોનો દાવો છે કે આ હરાજીથી સરકારના દેવા પર વધુ અસર થવાની નથી. કારણ કે સરકાર પર ઘણું દેવું છે. એક રિપોર્ટ અનસાર. ઇટલી પર લગભગ ૨.૪૮ ટિલિયન ડોલરનું દેવં છે અને આ દેવું ઇટલીના જીડીપીના લગભગ ૧૩૫ ટકા છે. આ દિવસોમાં ઈટલીમાં સરકારની નીતિઓની ખૂબ ટીકા થઈ રહી છે. કોઈને કોઈ રીતે સરકાર તેની ડૂબતી આર્થિક સ્થિતિને સુધારવાનો પ્રયાસ કરી રહી છે.

# સિદ્ધ મુસેવાલા હત્યા કેસના બે આરોપીને AGTFએ ઝડપી લીધા

મે ૨૦૨૨ માં, પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાને દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાએ મુસેવાલાના ચાહકોને આંચકો આપ્યો હતો જોકે મોત બાદ પંજાબના રાજકારણમાં પણ ભારે હલચલ મચી ગઈ હતી. કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈએ સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી, ત્યારબાદ પંજાબ પોલીસ મુસેવાલા ગુનેગારોને પકડવાના તમામ પ્રયાસો કરી રહી છે. પરંતુ આજે પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે. પંજાબમાં ટાર્ગેટ કિલિંગ અને ગેંગ વોરના મોટા ષડયંત્રનો પર્દાફાશ કરતા પંજાબ પોલીસે બે ગેંગસ્ટરની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બે ગેંગસ્ટર મનદીપ સિંહ અને જતિન્દર સિંહ છે જે લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રા૨ ગેંગ સાથે જોડાયેલા છે. પંજાબ પોલીસના ડીજીપી ગૌ૨વ યાદવે સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેણે જણાવ્યું કે પકડાયેલા આરોપી મનદીપે સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ આરોપીઓને આશ્રય આપ્યો હતો. આ સિવાય ૨૦૧૭માં તેણે ગેંગસ્ટર દીપક ટીનુને ભાગવામાં પણ મદદ કરી હતી. આ બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેમની સામે ચંદીગઢ અને હરિયાણામાં હત્યાના પ્રયાસ, ખંડણી, લુંટ, આર્મ્સ એક્ટ વગેરેના અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓને વિદેશમાં બેઠેલા તેમના આકાઓએ હરીફ ગેંગસ્ટરોની ટાર્ગેટ કિલિંગ કરવાનું કામ સોંપ્યું હતું. આ બે આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને ૧૨ જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. વર્ષ ૨૦૨૨ માં, ૨૯ મેના રોજ, પ્રખ્યાત ગાયક શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. કેનેડામાં બેઠેલો ગોલ્ડી બ્રાર આ પાછળનો મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. ગોલ્ડી બ્રાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્રોઈ ગેંગનો સહયોગી છે. તમને જણાવી દઈએ કે મુસેવાલા હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્રોઈએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA દ્વારા પૂછપરછ દરમિયાન સનસનાટીભર્યા દાવા કર્યા હતા. લોરેન્સે કહ્યું કે તેશે આ પહેલા પંજાબી સિંગર સિદ્ઘુ મુસેવાલાની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

## TIHIL

#### ટાંસ ઇન્ડિયા હાઉસ ઇમ્પેક્ષ લિમિટેડ ( જે આઈઓ સિસ્ટમ લિમિટેડ તરીકે ઓળખાતી) રજી. ઓફિસઃ બી- ૧૧૦૧, ટિટેનિયમ સ્કેવર, સર્વેશ્વર ટૉવર પાછળ, બીએમડબ્લ્યુ શૉ રૂમ સામે, થલતેજ, અમદાવાદ- ૩૮૦૦૫૪, ગુજરાત ઇન્ડિયા ઈમેલઃ COMPLIANCE@TIHIL.CO.IN, ટેલીઃ + ૯૧. ૭૯-૪૬૦૦૮૧૦૮ વેબસાઇટ : WWW.TIHIL.CO.IN, CIN : L74110UP1987PLC008764

૩૧મી ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ પુરા થતા નવમાસિક અને તિમાસિક અંતે સ્ટેન્ડલોન અન-ઓડિટેડ નાણાંકીય પરિણામ ના સ્ટેન્ડએલોન નો ઉતારો (તમામ ૨કમ ૩. લાખમાં અન્યથા જયાં સધી જણાવવામાં ન આવે)

ક્ર. સં <sub>ત્રિ</sub> ઃ	વિગતો પાસિકના અંતે	૩૧.૧૨.૨૦૨૩ ત્રિમાસિકના અંતે ( અન ઓડિટેડ)	૩૧.૧૨.૨૦૨૨ ત્રિમાસિકના અંતે ( અન ઓડિટેડ)	૩૧.૧૨.૨૦૨૩ નવમાસિકના અંતે ( અન ઓડિટેડ)	૩૧.૦૩.૨૦૨૩ વર્ષના અંતે (ઓડિટેડ)
٩.	કામકાજમાંથી કુલ આવક (ચોખ્ખી)	2,627.22	392.37	7,031.14	3,446.66
૨.	ચોખ્ખો નફો / (નુકશાન) (ટેક્સ પહેલાની, અસામાન્ય અને / અથવા વિશિષ્ટ પ્રકારની આઇટમો)	34.19	70.23	174.21	295.19
з. v.	ચોખ્ખો નફો / (નુકશાન) (ટેક્સ પહેલાની, અસામાન્ય અને / અથવા વિશિષ્ટ પ્રકારની આઇટમો) ચોખ્ખો નફો / (નુકશાન) (ટેક્સ પહેલાની, અસામાન્ય અને / અથવા વિશિષ્ટ પ્રકારની	34.19	70.23	174.21	295.19
	આઇટમો)	25.64	70.23	130.41	292.09
ч.	નફો / (નુકશાન) ટેક્સ પછી અને બીજી સાંયોગિક આવક અથવા અસાધારણ આય (ટેક્સ પછી)				
	, , , ,	25.64	70.23	130.41	292.09
ų. 9.	ઇક્વિટી શેરમૂડી ગત વર્ષના ઓડીટેડ બેલેન્સશીટમાં કરેલી જોગવાઈ પ્રમાણે અનામત (અનામતનું	3,192.60	1,690.00	3,192.60	1,690.00
८.	મુલ્યાંકન પ્રમાણે) શેરદીઠ કમાણી (અસાધારણ આઈટમો બાદ)	-		-	-901.94
	(રૂા. ૧૦/- પ્રત્યેક) (જાહેર નથી કરેલ) : રૂા. માં				
	(એ) બેઝિક (બી) ડાલ્યુટેડ	0.08 0.08	0.42 0.42	0.41 0.41	1.73 1.73
નોંધ	•				

. ઉપરોક્ત મુજબના મુદ્દાઓની માહિતી અન ઓડિટેડ સ્ટેન્ડ એલોન નાણાંકીય પરિણામમાં જે ત્રિમાસિક અને નવ માસિક ૩૧ િડસેમ્બર, ૨૦૨૩ ના રોજ પુરા થાય છે તે સેબી રેગ્યુલેટરે તે સ્ટોક એક્ષચેન્જમાં સેબીની કલમ ૩૩ (લિસ્ટીંગ એન્ડ અધર િડસકલોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ મુજબ વાર્ષિક નાણાંકીય પરિણામોની સંપૂર્ણ માહિતી સ્ટોક એક્સચેંજની વેબસાઇટ www.bseindia.com અને કંપની વેબસાઇટ www.tihil.co,in ઉપર પણ ઉપલબ્ધ છે.

ટ્રાંસ ઇન્ડિયા હાઉસ ઇમ્પેક્ષ લિમિટેડ વતી મયંક એસ જોલી ચેરપરશન અને હૉલ- ટાઇમ ડિરેક્ટર સ્થળ: અમદાવાદ તારીખ:૦૫/૦૨/૨૦૨૪ ડિન : ૦૯૩૬૬૧૭૫.

PUBLIC NOTICE
THE ANUP ENGINEERING LIMITED

Regd office: Behind 66 Kv Electric Sub Station Odhav Road, Ahmedabad Gujarat - 382415 NOTICE is hereby given that the certificate for the under mentioned securities of the company has/have been lost /mislaid and holder of the said securities / applicant has have applied to the company to issue Duplicate certificate.

Any person who has claim in respect of the said securities should lodge such claim with the company at its registered office within 15 days from this date, else the company will proceed to issue duplicate certificate without further intimation. Name Of Holder: 1) Shreyas Sumanchand Sheth

2) Smt Jayshree Shreyas Sheth Certificate no.(s) No of shares/deb. Distinctive (s) Foilo No 186616 - 187324 S00260 709 Place: Mumbai Date: 06-02-2024

# કેનેડાની સરકારે સ્ટુડન્ટ વિઝાના નિયમો કર્યા કડક

કેનેડિયન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નવી અભ્યાસ પરમિટ પર બે વર્ષની મર્યાદા જાહેર કરી છે. જેના કારણે આ વર્ષે લગભગ ૩.૬૦.૦૦૦ વિદ્યાર્થીઓને વિઝા મળવાની અપેક્ષા છે. આ વર્ષે એવી ધારણા છે કે ૨૦૨૩ની સરખામણીએ અંદાજે ૩૫ ટકા ઓછા વિઝા ઉપલબ્ધ થશે. આ જાણકારી ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આપી હતી.

સોમવારે જણાવ્યું હતું કે તાજેતરના પરમિટની સંખ્યાનું આ વર્ષના અંતમાં વર્ષોમાં તેમના વધતા પ્રવાહને કારણે દેશમાં વધતી જતી હાઉસિંગ કટોકટી પછી સરકારને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે માર્ક મિલરે કહ્યું કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના સમુદાયને સમૃદ્ધ બનાવે છે. મિલરે ટ્વિટર પર લખ્યું, "મેં ૨૦૨૪ થી શરૂ થતી નવી અભ્યાસ પરમિટની બે વર્ષની મર્યાદાની જાહેરાત કરી છે."

૩૬૦,૦૦૦ અભ્યાસ પરમિટ મંજુર લાઇસન્સિંગ શાસન હેઠળ અભ્યાસ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦ લાખના આંકડાને વટાવી ગઈ છે. નવેમ્બર ૨૦૨૩ સુધીમાં જારી કરાયેલી ૫,૭૯,૦૭૫ પરમિટમાંથી ભારતીયો ૨,૧૫,૧૯૦ સાથે સૌથી આગળ હતા. મિલરે જણાવ્યં હતં કે કાર્યક્રમની અખંડિતતાને સુનિશ્ચિત કરવા અને શૈક્ષણિક અનુભવને જાળવવા માટે, કેનેડા સુધારાઓ અમલમાં મૂકવાનું ચાલુ રાખશે અને ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે ૨૦૨૫ માં જારી કરવામાં આવનાર પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે. મિલરે જણાવ્યું હતું કે મર્યાદા લાદીને, સરકાર કેટલીક નાની ખાનગી કોલેજો સામે પગલાં લઈ રહી છે જેઓ ઓછા સંસાધનવાળા કેમ્પસ ચલાવીને અને ઊંચી ટ્યાશન ફી વસુલીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો લાભ લઈ રહી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આના પરિણામે આ વર્ષે અંદાજે સપ્ટેમ્બરથી શરૂ કરીને, કેનેડા કોર્સ

# મહેસાણાના ઉમિયા માતાજી મંદિરનો છ કેટેગરીમાં સમાવેશ કરાયો

કમાણીથી મા ઉમિયાનું મંદિર ઉભું થયું છે. દેશવિદેશમાં વસતા પાટીદારોનં આસ્થાનું કેન્દ્ર છે ઉમિયા માતાનું મંદિર. ઊંઝામાં આવેલું આ મંદિરની સિદ્ધિમાં દિલીપ પટેલે જણાવ્યું કે, ઉમિયા માતાજી વધુ એક ઉમેરો થયો છે. ઉંઝા ઉમિયા મંદિર, ઊંઝાનો અકક્ષાના તીર્થસ્થાનમાં માતાજી મંદિરનો 'અ' કક્ષાના તીર્થ સ્થાનમાં સમાવેશ થયો છે. રાજ્ય સરકાર દ્વારા ઉમિયા માતાજી મંદિરને તીર્થસ્થાન કેટેગરીમાં આ ફેરફાર કરાયો છે. ઉંઝામાં પૂર્વેનું છે. મા ઉમિયા પ્રત્યેની લોકોની આવેલું ઉમિયા માતા મંદિર જગવિખ્યાત છે. ત્યારે અત્યાર સુધી ઉમિયા માતાજી મંદિર 'બ' કેટેગરીમાં હતું, ત્યારે હવે રાજ્ય સરકારે તેને 'બ' કક્ષામાંથી બદલીને 'અ' કક્ષામાં સમાવેશ કર્યો છે. જેથી મા ઉમિયાના ભક્તો આનંદમાં

ખોવાચેલા વેચાણ ખત

અંગે સૂચના

કે જ્યાં બ્લિસ કોમર્શિયલ પ્રા.લિ.એ બિન

ખેતીલાયક જમીનના કાયદેસર માલિક છે જે

સર્વે નં.૫૩૫/૨/૨/૩/૧ ખાતે સ્થિત, માપણ

૨૫૨૦ સ્કે.મી.,ગામ સાચલી, સિલવાસા, દાદરા

નગર અને હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશમાં

આવેલ છે. આથી નોટિસ આપવામાં આવે છે

કે ૧૮મી જુલાઈ ૨૦૦૦ના રોજ મેસર્સ અજર

એન્ટરપ્રાઈઝ અને બ્લિસ કોમર્શિયલ પ્રા.લિ. વચ્ચે વેચાણ ડીડ દાખલ કરવામાં આવી હતી

જે બ્લિસ કોમર્શિયલ પ્રા.લિ.એ અજય

એન્ટરપ્રાઈઝ પાસેથી ઉપરોક્ત જમીન ખરીદી

તી અને જે સબરજીસ્ટ્રાર ની ઓફ્સિમાં રજ

કરવામાં આવી હતી. દાદરા અને નગર હવેલીન

રજિસ્ટ્રાર, સિલવાસાને ૧૯મી જુલાઈ ૨૦૦૦ન

રોજ સિરિચલ નં.૧૧૮૦/૨૦૦૦ પર કંપનીની

રજી.ઓફ્સિ ૪૦૧, ઝુલેલાલ, ૧૬મો રોડ, ખાર

(વેસ્ટ), મુંબઈ ૪૦૦૦૫૨ ખાતે રાખવામાં આવી

હતી. અને તે મૂળ વેચાણ ખત ખોવાઈ ગયો છે

अने ते शोधी शडातो नथी अने ते अंगेनी

ફરિયાદ ખાર પોલિસ સ્ટેશનમાં રજી

ફેબ્રુઆરી,૨૦૨૪ના રોજ ખોલાઈ ગયેલ રિપોર્ટ

નં.૧૫૬७૫-૨૦૨૪ હેઠળ નોંધવામાં આવી છે

આ નોટિસના પ્રકાશિત થયાના સાત દિવસર્ન

અંદર ઉપોરક્ત જણાવેલ મળ વેચાણ ખત જે

આપને મલે છે તો કૃપા કરીને બ્લિસ કોમર્શિયલ

પ્રા.લિ., ૪૦૧, ઝૂલેલાલ, ૧૬મો રોડ, ખાર (વેસ્ટ), મુંબઈ ૪૦૦૦૫૨ ખાતે પરત આપશોજી

તારીખ : ૦૬/૦૨/૨૦૨૪

પાટીદારોના પરસેવાની આવી ગયા છે. ઉમિયા માતાજી મંદિર હોદ્દેદારોએ આ અંગે મુખ્યમંત્રીને મળીને આભાર વ્યક્ત કર્યો હતો. આ વિશે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના ઊંઝાનગરમાં મા ઉમિયાનું પૌરાણિક મંદિર લગભગ ૧૮૬૮ વર્ષ શ્રધ્ધા ભકિતમાં અનેક ધણો વધારો થયો છે. દર વર્ષે જગત જનની મા ઉમિયાના દિવ્ય દર્શન કરવા તમામ જ્ઞાતિ-જાતિના ૭૫ લાખથી વધારે ભક્તો પધારે છે.

સરકારે થવાની ધારણા છે. કેનેડામાં કરતા વિદ્યાર્થીઓને અનુસ્નાતક વર્ક પરમિટ (PGWPs) જારી કરશે નહીં. "આ કાર્યક્રમો તેમની દેખરેખના અભાવ માટે ક્રખ્યાત છે અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક અનુભવ પ્રદાન કરતા નથી જેના માટે કેનેડા પ્રખ્યાત છે." મિલરે કહ્યું. મંત્રીએ કહ્યું કે આગામી સપ્તાહોમાં, દેશ હવે માસ્ટર્સ અને ડોક્ટરલ પ્રોગ્રામ્સ સિવાય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના જીવનસાથીઓને વર્ક પરમિટ આપશે નહીં. અગાઉ, એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ વર્ષથી શરૂ કરીને, વિદ્યાર્થીઓએ તેમની એક વર્ષની ટ્યુશન ફ્રી ઉપરાંત તેમના ખાતામાં ઓછામાં ઓછા ૨૦,૬૩૫ કેનેડિયન ડોલર દર્શાવવાના રહેશે.

## પશ્ચિમ રેલવે – અમદાવાદ ડિવિઝન

**સુધારો** બેનઆઈટી નં. 35 વર્ષ 2023-2024 તા.18 01-2024 ના ટેન્ડર નં. **ડીઆરએમ-એડીઆઈ-**159, 160 અને 163-2023-24 ની ટેન્ડર ખુલવાની તારીખ 13-02-2024 ને બદલે 20-02-2024 વાંચવાની રહેશે, વિગતો નીચે મુજબ છે ટેન્ડર નં. **ડીઆરએમ-એડીઆઈ-**159, 160 અને 163-2023-24-2023-24 ખુલવાની તારીખ: 20-02-2024. ઉપરોક્ત ટેન્ડર નોટીસના અન્ય તમામ નિયમો અને શરતો અપરિવર્તનીય રહેશે. ADI-262

#### અમને ફોલો કરોઃ 🔀 twitter.com/WesternRly

પશ્ચિમ રેલવે – રાજકોટ ડિવિઝન OHE ફેરફાર કામ

**ટેન્ડર નોટીસ નં.** ડીઆરએમ/આરજેટી/ઈ ટેન્ડર/ઈએલ/ટીઆરડી/2023-2024/27 તા.30-01-2024. ટેન્ડર નં. ડીઆરએમ-આરજેટી-ઈએલ-ટીઆરડી-2023-24-27 (i) કામનું નામઃ રાજકોટ ડિવિઝનના કિ.મી. 993/4-5 (ભીમરાણા-ઓખા સેક્શન) ખાતે LC નં. 313 ને બદલે ROB અને RUB ની જોગવાઈ અને બ્રિજ નં. 391 (લાખાબાવળ-પીપળી સેક્શન) ખાતે ગર્ડર બ્રિજને બદલે RCC સ્લેબ બ્રિજની જોગવાઈના સંબંધમાં OHE માં કેરકારના કામ (ii) અંદાજીત પડતરઃ ₹ 40,16,728.94/- (iii) અર્નેસ્ટ મનીઃ ₹ 80,300/- (iv) ઓન લાઈન અરજી **કરવાની તારીખ અને સમયઃ** તા.27-02-2024 ના 15:00 કલાક સુધી. (v) ઓફીસનું સરનામું: ડિવિઝનલ રેલવે મેનેજર (ઈલેક્ટિકલ/ટેક્શન), પશ્ચિમ રેલવે, કોર્ઠ કમ્પાઉન્ડ, રાજકોટ-360 001. **વેબસાઈટ વિગતઃ** 

અमने साध्र हरोः f facebook.com/W



એએમસી દ્વારા ઈન્કમટેક્સ બ્રિજની સાઈડની દિવાલને પાણી સફાઈ કરવામાં આવી હતી.

## પશ્ચિમ રેલવે – અમદાવાદ ડિવિઝન

પ્રદર્શન ગેલેરી માટે એજન્સીની નિમણક મારતના રાષ્ટ્રપતિ માટે અને વતી ડેપ્યુટી ચીફ એન્જીનીયર (ગતિ શક્તિ) પશ્ચિમ રેલવે, અમદાવાદ નીચે જણાવેલ કામ માટે ઈ-ટેન્ડર આમંત્રિત કરે છે. ઈ–ટેન્ડર નોટીસ નં. સીપીએમ/જીએસ/એડીઆઈ/ વડ-એક્ઝ/06 (1) કામનું નામ તેના સ્થળ સહિતઃ વડનગર ગુજરાત, ભારત ખાતે ટર્નકી ધોરણ પર "પ્રદર્શન ગેલેરી" ના કોન્સેપ્ટ, ડિઝાઈન, નિર્માણ, વલપમેન્ટ માટે એજન્સીની નિમણુક. (2) **કામની** અંદાજીત પડતરઃ ₹ 5,06,83,677.00 (3) ૪મા કરાવવાની અર્નેસ્ટ મની ડિપોઝીટઃ ₹ 4,03,400.00 (4) **ટેન્ડર ફોર્મ ફીઃ** નિઃશુલ્ક (5) **કાર્ય પૂર્ણ કરવાનો સમયગાળોઃ** 12 (બાર) મહિના યોમાસા સાથે **(6) ઈ-ટેન્ડર બંધ થવાની તારીખ અને સમયઃ** તા.04-03-2024 ના 15:00 કલાકે (7) બસાઈટ વિગત અને નોટીસ બોર્ડનું સ્થળ જ્યાં ન્ડરની સંપૂર્ણ વિગતો જોઈ શકાશે અને ઓફીસનું ારનામુંઃ <mark>વેબસાઈટઃ <u>www.ireps.gov.in</u> ચીફ</mark> પ્રોજેક્ટ મેનેજર/ગતિ શક્તિની ઓફીસ, "A" વિંગ, યોથો માળ, નિર્માણ ભવન, ડીઆરએમ ઓફિસ પાસે, પશ્ચિમ રેલવે. અમદાવાદ-382345.

અમને લાઇક કરોઃ f facebook.com/WesternRly

## અશનિશા ઈન્ડસ્ટ્રીસ લિમીટેડ

CIN: U74110GJ2009PLC057629 રજીસ્ટર્ડ ઓફીસ: ૭મે માળ, અશોકા ચેમ્બસૅ, મીઠાખળી છ રસ્તા, અમદાવાદ ૩૮૦૦૦૬. કોન નં, : ૦૭૯ ૨૬૪૬૩૨૨૭. e-mail ID : ashnishalimited@gmail.com, Website : www.ashnisha.in

<mark>વધારાની</mark> સામાન્ય સભા તથા ઈ – વોર્ટીંગ માહિતીની નોટિસ

ળાથી સબ્યોને જણાવવામાં આવે છે કે <mark>મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અકેસેના પરિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. ૮મી એપ</mark>િલ, ૨૦૨૦, પરિપત્ર ન ૧૭/૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ. ૨૦૨૦ અને પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી મે. ૨૦૨૦ (એમ.સી.એ. પરિપત્રો) તથા સિક્યોરિટીઝ ૧૭/૨૦૨૦ તા. ૧૭ના આવેલ, ૨૦૨૦ અને પારંપત્ર ન ૧૦/૨૦૨૦ તા. પત્ત ન, ૨૦૨૦ (અમ.સા.અ. યારપત્ર) તેવા લિકપાસ્ટાઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના પરિપત્ર નં SEB/HO/CFD/CMD/ICIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦ (સેબી પરિપત્ર) અને અન્ય તમામ સંબંધિત પરિપત્રો સમયાંતરે જારી કરવામાં આવેલ છે. તેને ધ્યાનમા રાખીને કંપનીના સબ્યોની વધારાની સામાન્ય સભા (ઈ.ઓ.જી.એમ.) ૧.લી માર્ચ, ૨૦૨૪, શુક્રવારના રોજ બપોરે ૩:૩૦ વાગે વિડિયો કોન્ફરન્સ (વી.સી.) અન્ય ઓડિયો વિઝયુલ નાધ્યમ (ઓ.એ.વી.એમ.) દ્વારા યોજાશે, જેમા ઈ.ઓ.જી.એમ.ની નોટિસમા દર્શોવામાં આવ્યા મુજબના ભિઝનેસ હાથ ધરાશે

રીમોટ ઈ-વોર્ટીગ : કંપનીઝ એક્ડ, ર૦૧૩ની કલમ ૧૦૮, કંપનીઝ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) અમેન્ડમેન્ટ ફ્લ્સ, ર૦૧પના નિયમ ર૦ અને સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ઉસ્કલોઝર રીકવાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧પના, રેગ્યુલેશન ૪૪ અન્વયે કંપની ઈ.ઓ.જી.એસ.એલ. નોડીસમાં દર્શાવેલા કામકાજ અંગે વધારાની સામાન્ય સભામાં ઇલેક્ડ્રોનિક માધ્યમથી મત આપી શકે તે માટે સભ્યોને સી.ડી.એસ.એલ. ના માધ્યમથી રીમોટ ઈ-વોર્ટીંગની સુવિધા પુરી પાડે છે. સભ્યોને મોક્લવામાં આવેલી ઈ.ઓ.જી.એમ.ની નોડીસમાં રીમોટ ઈ-વોર્ટીંગ અંગે વિસ્તૃત સૂચના આપવામાં આવી છે.કંપનીઝ એક્ટ, ર૦૧૩ અન્વયે પૂરી પાડવામાં આવતી વિગતો તથા નિયમો નીચે મુજબ છે :

ઈ – વોર્ટીગની સમયમર્યાદા: ઈ – વોર્ટીગ ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૨૪ ના સવારે ૯:૦૦ કલાકે શરૂ થશે અને ૨૯મી ફેબ્રુઆરી, ૨૦૨૪ ન સાંજે પઃ૦૦ કલાકે પૂર્ણ થશે. ૩. ઈ.ઓ.જી.એમ.ની નોટીસ

સાજ પ:૦૦ કલાક પૂરા થશ. . ઈ.ઓ.જી.એમ.ની નોટીસ કંપનીની વેબસાઈટ www.ashnisha.in તથા સી.ડી.એસ.એલ.ની વેબસાઈટ www.evotingindia.com તથા બી.એસ.ઈ.ની વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. . જો કોઈ વ્યક્તિ ઈ.ઓ.જી.એમ.ની નોટીસ મોકલ્યા બાદ શેર હસ્તગત કરે અને કંપનીના સભ્ય બને તથા ૨૩મી ફેબ્રુઆરી, ૨૦૨૪ ની ક્ટ ઓફ તારીખ સુધીમાં શેર ધરાવતા હોય, તો તે ઈ.ઓ.જી.એમ.ની નોટીસમાં દર્શાવેલી રીમોટ ઈ-વોર્ટીગની સૂચના અને પ્રક્રિય

કટ અહ તારા તે જુવાના તેર વર્તાસા હતું. તા તે છે.આ.છું. અને ના નાટાસના સ્વાવના સામલા સામાટ છે-વાટારાત પુત્રના અસ અનુસરીને તેમનો મત આપી શકે છે. જે વ્યક્તિનું નામ કટ ઓફ તારીખ સુધીમાં સબ્યોના રજિસ્ટરમાં હોય અથવા ડીપોઝીટરીઝ દ્વારા જાળવવામાં આવતા બેનીફીશીયલ ઓનર્સના રજિસ્ટરમાં હોય, તે જ ઈ.ઓ.જી.એમ.માં મત આપવા તથા રીમોટ ઈ – વોર્ટીગની સુવિધાનો ઉપયોગ કરવા હકદાર રહેશે. સબ્યો રીમોટ ઈ – વોર્ટીગ દ્વારા તેમનો મત આપવા બાદ પણ સામાન્ય સભામાં ભાગ લઈ શકરો, પરંતુ સભામાં ફરીવાર મત આપી

શકશે નહીં. . જે સબ્યોએ રીમોટ ઈ–વોર્ટીગ દ્વારા તેમનો મત ન આપ્યો હોય, તે ઈ.ઓ.જી.એમ.માં મત્તાધિકારનો ઉપયોગ કરી શકશે. . ઈ–વોર્ટીગની સુવિધા, ઈ.ઓ.જી.એમ.માં હાજર રહેવાની પ્રક્રિયા અને ઈ–મેઈલ સરનામાની નોંધણીની પ્રક્રિયા ઈ.ઓ.જી.એમ.ની નોટિસમાં આપવામાં આવી છે. . ઈ–વોર્ટીગને લગતો કોઈ પ્રશ્ન હોય તો સબ્યો / બેનીફીસીયલ ઓનર્સ helpdesk.evoting@cdslindia.com પર ઈ–મેઈલ કરી

શકે છે અથવા ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૨ ૫૫ ૩૩ ૫૨ સંપર્ક કરી શકશે.

સ્થળ: અમદાવાદ તારીખ: ૦૫.૦૨.૨૦૨૪

## અશનિશા ઈન્ડસ્ટ્રીસ લિમીટેડ

બોડ ઓફ ડિરેક્ટર્સના આફેશથી અશોક શાહ

મેનેજીંગ ડીરેકટ ડીઆઇએન : ૦૨૪૬૭૮૩૦

## **YASH CHEMEX LIMITED**

411,4TH FLOOR,SIGMA ICON-1,OPP. MEDILINK HOSPITAL SATELITE,AHMEDABAD-380015.

TELE:- 079-40028639, Email:- yashchem@hotmail.com, Website:- www.yashchemex.com

CIN:- L74110G12006PLC048385

Statement of Standalone and Consolidated Unaudited Financial Results for the Quarter and Nine Months Ended December 31,2023

	Standalone Unudited Financial Results Consolidated Unaudited Financial Resul								esults
	Particulars	Quarter Ended 31/12/2023	Quarter Ended 30/09/2023	Quarter Ended 31/12/2022	Year Ended 31/03/2023	Quarter Ended 31/12/2023	Quarter Ended 30/09/2023	Quarter Ended 31/12/2022	Year Ended 31/03/2023
1	Total Income from Operations	1,690.37	1,311.50	2,895.50	5,632.90	1,901.08	1,939.22	2,173.50	9,141.9
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	21.02	46.30	(7.68)	50.87	55.23	193.32	43.45	472.27
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	21.02	46.30	(7.68)	50.87	55.23	193.32	43.45	472.2
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	24.57	33.17	(6.10)	38.82	52.35	151.10	34.30	381.59
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	50.76	48.98	(23.34)	113.98	78.53	166.91	65.98	457.07
6	Equity Share Capital of Face Value Rs.10/- Each	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.3
7	Earnings Per Share (of Rs. 10/- Each) (for continuing & discountued operatoions):								
	A: Basic	0.24	0.32	(0.06)	0.38	0.38	0.73	(2.56)	2.73
	B: Diluted	0.24	0.32	(0.06)	0.38	0.38	0.73	(2.56)	2.73

The above is an Extract of the detailed format of unaudited Quarter and Nine months ended December 31,2023 Standalone and Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website i.e. www.bseindia.com and www.nseindia.com and on the website of the Comapny i.e. www.yashchemex.com.

The above unaudited Standalone and Consolidated Financial Results for the Quarter and Nine months ended December 31,2023 have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors in their respective meetings held on February 05, 2024. The Review as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the statutory auditor of the company and the related report i submitted to the concerned stock exchanges.

The unaudited Standalone and Consolidated Financial Results for the Quarter and Nine months ended December 31,2023 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and

olicies to the extent applicable. By Order of Board of Directors

**Pritesh Shah** DIN: 00239665

Place : Ahmedabad Date : February 05, 2024

#### પશ્ચિમ રેલવે – અમદાવાદ ડિવિઝન પાર્સલ સ્પેસ લિઝીંગ પર આપવા માટે ઈ-હરાજી

ઉપરોક્ત સંદર્ભમાં, અમદાવાદ ડિવિઝન થી શરૂ થતી પેસેન્જર લઈ જતી ટ્રેનોમાં,નીચે મુજબન આઈઆરઈપીએસ વેબસાઈટ પર પહેલે થી પ્રકાશિત કરવામાં આવેલ, કેટલોગ માટે પાર્સઈ સ્પેસ લિઝીંગ પર આપવાની ઈ-હરાજી માટે બીડ્સ આમંત્રિત કરવામાં આવે છે. વિગતો નીચે મુજબ આપવામાં આવેલ છે.

કેટલોગ નં.	કોન્ટ્રાક્ટનો પ્રકાર	કેટેગરી	ઈ-હરાજી ની તારીખ અને સમય				
DI-Lease- 16-24	પાર્સલ	પાર્સલ - SLR અને પાર્સલ વાન	લોટ માટે ઈ–હરાજી તા.16-02-2024 ના 11:00 કલાકે શરૂ થશે.				

નોંધ : પ્રસ્તાવિત બિડર્સને IREPS વેબસાઈટ (www.ireps.gov.in) પર ઈ-હરાજી લીઝિંગ મોડ્યૂલન મલાકાત લેવા વિનંતી કરવામાં આવે છે. લોટ વાઈઝ વિગતો ઉપરોક્ત દર્શાવેલા કેટલોગ નંબર હેઠળ ઉપલબ્ધ છે પ્રારંભિક કૂલિંગ ઑફ પિરિયડ 30 મિનિટ છે. સફળ લોટ બંધ થવાનું મધ્યાંતર 10 મિનિટ છે. લોટ-વાઈઝ બંધ થવાનો સમય આઈઆરઈપીએસ ના ઈ-હરાજી મોડ્યૂલ માં જોઈ શકાશે

અમને લાઇક કરોઃ 🚹 facebook.com/WesternRly • અમને ફોલો કરોઃ 🔀 twitter.com/

### શ્રીરામ હાઉસિંગ ફાયાનાન્સ લીમીટેડ

SHRIR & M

જી. **ઓકિસ:** ઓકિસ નું ૧૨૩ અન્ગપ્પા નૈકેન સ્ટીટ ચેથાઈ- ૬૦૦ ૦૦ હેડ ઓફિસ : લેવલ ૧, વૉક હાર્ટ ટોવર, ઈસ્ટ વિન્ગ, સી-૨, જી-બ્લોક, બાંન્દ્રા કુર્લા કોમ્પ્લેક્ષ, બાંદ્રા (ઈસ્ટ), મુંબઈ ૪૦૦ ૦૫૧ વેબસાઇટ : www.shriramhousing.in

## સાંકેતિક કબ્જા નોટીસ

આથી અહીં જણાવવાનું કે નીચે સહી કરનાર શ્રીરામ હાઉસિંગ ફાયનાન્સ લિમીટેડ (એસએચએફએલ)ના અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇઝેશન અને રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ (**જણાવેલ કાયદા)** નિયમો, ૨૦૦૨ (જણાવેલ નિયમો)ના નિયમ ૩ સાથે વંચાતી કલમ૧૩(૧૨) હેઠળ મળેલી સત્તાની રૂએ નીચે કોષ્ટકમાં જણાવેલ કરજદારોને જણાવેલ માંગણા નોટીસોમાં જણાવેલ ૨કમ પરત ચુકવવા માંગણા નોટીસો જારી કરી હતી.

રજદારો રકમની પુનઃચુકવણી કરવામાં નિષ્ફળ ગયા છે.પરિણામે કરજદારો અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અહી નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇઝેશન એન્ડ રિકન્સટ્રક્શન ફાયનેન્શીયલ એસેટ્સ અનેસિક્યોરીટી ઇન્ટરેસ્ટ એન્ફ્રોર્સમેન્ટ નિયમ, ૨૦૦૨ના નિયમ ૧૩(૪) વંચાણે લેતા મળેલી સત્તાની રૂએ ૦૩/૦૨/૨૦૨૪ના રોજ કાર્યવાહી કરી નીચે વર્શન કરવામાં આવેલ તેના/તેણી નામે રહેલ મિલ્કતનો સાંકેતિક કબ્જો મેળવી લીધો છે.

કરજદાર અને ખાસ કરી જાહેર જનતાને મિલકત સાથે કોઈ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઈપણ સોદો શ્રી રામ હાઉસિંગ ફાયનાન્સ્ લી.ની નીચે જણાવેલ ૨કમ તેમજ તેના પર વ્યાજના ચાર્જને આધિન રહેશે.

કરજદારો ધ્યાન આપે કે આ કાયદાની કલમ ૧૩ ની પેટા કલમ (૮) મુજબ આ ગીરો મિલકત મકત કરાવવાનો સમય મળે છે

3/1 33/13 11 11 11 11 11 11 11 11 11 11 11 11 1	
કરજદારનું નામ અને સરનામું	
૧. જગદીશભાઈ મોહનલાલ ભોલાણી,	_
૨. શારદાબેન ભોલાણી જગદીશભાઈ	
વ્યક્તિગત સરનામું ઃ- નન્દન પાર્ક-૧,	
ામેશ્વર પાછળ, જામનગર- ૩૬૧૦૦૮.	
અન્ય બિઝનેસ સરનામું ઃ	
ກາງຕະລາຍ ຈະຄວາມການຄ້າ	

પટેલ વાડી, નવા ગામ ઘેડ, ડાંગરવાડા, કાલાવડ, જામનગર- ૩૬૧૦૦૮ અન્ય બિઝનેસ સરનામું : મોહનલાલ હિરાનન્દ, સ્ટેશન રોડ, કે.નં. ૧૯૪, જામનગર-

અન્ય મિલકત સરનામું : સબ- પ્લોટ નં. ૪/૬, નંદન પાર્ક-૧. જલારામ નગર પાસે. ઓફ બેડી બંદર રોડ, નવાગામ ઘેડ, જામનગર-381004

માંગણા નોટિસ મુજબ બાકી રકમ રૂા. ૯,૨૧,૯૯૧/-(રૂપિયા નવ લાખ એક્વીસ હજાર નવ સો એકાણું પુરા) જે ૦૬ નવે.-૨૩ સુધ રેફ્રેન્સ ઓફ લોન એકાઉન્ટ નં.SBTHJMNG0000154 અને રૂા. ૪,૭૪,૬૨૭/- ( રૂપિયા ચાર લાખ ચુવોતેર હજાર છ સો સતાવીસ પરા) જે

#### એકાઉન્ટ નં.STUHJMNG0000178

૦૬- નવે.-૨૩ સુધી રેફ્રેન્સ ઓફ લોન

ઉપરોક્ત નિર્ધારિત વ્યાજ દર,સાથે જણાવેલ નોટીસ પ્રસિધ્ધ અને પ્રાપ્ત થયાના ૬૦ દિવસની અંદર ચુકવી દેવી ૧૩(૨)નોટિસ તારીખ.૧૬/૧૧/૨૦૨૩

મિલકતનું વિવરણ

જામનગર મ્યુન્સિપલ કૉર્પોરેશન ના જામનગર સિટી ની સીમામાં નવાગામ ઘેડ વિસ્તારમ અસલ લેન્ડ ઓફ આરએસ નં. ૨૩૯/૧, કુલ માપ એરિયા ૮૦૨૧,૦૦ સ્કેવર મી. જામનગર મ્યન્સિપલ કૉર્પોરેશન એ મંજર કરેલ લે-આઉટ પ્લાન અને કલેક્ટર જામનગર એ જેને નૉન એગ્રીકલ્ચર લેન્ડમા રેસીડેન્સીયલ હેતુથી પરિવર્તિત કરેલ અને આ જગ્યા ને લે-આઉટ પ્લાન મજબ ૧ થી ૬૨ રેસીડેન્સીયલ પ્લોટ - ૩૬૧૦૦૮. આ પ્લોટની બાહર . પ્લોટ નં.૪ થી ૧૯મ એકીકૃત કરીને નવો પ્લોટ નં. ૪ આપેલ અને નવો પ્લોટ નં. ૪ ને ૧૮ અલગ-અલગ સબ - પ્લોટ

આ પ્લોટની બાહર અલગ બાંધકામ સબ- પ્લોટ નં. ૪/૬ પ્લોટનો માપ એરિયા ૪૪.૨૪ સ્કેવર મી. બન્ને સાથે બાંધકામ છે.

નં. ૪/૧ થી ૪/૧૮ માં જામનગર મ્યુન્સિપલ કૉર્પોરેશન એ એપ્રૂવ્ડ કરેલ.

તમામ ભાગ અને હિસ્સો ઓફ રૉ હાઉસ જગ્યાનો માપ એરિયા 🛮 ૪૪.૨૪ સ્કેવર મી. અને સુપર બિલ્ડ-અ૫ એરિયા ૫૭.૬૯ સ્કેવર મી. જે ફાયનલ પ્લોટ નં. ૪/૬, સર્વે નં. આર એસઆર, નં ૨૩૯/૧, બ્લોક /બિલ્ડિંગ નં. ૪/૬, હાઉસ નં. ૪/૬, બિલ્ડિંગ/સોસાયટી નામ- નંદન પાર્ક, સ્ટ્રીટ નામ રિધ્ધિ સોસાયટી, રામેશ્વર નગર એરિયા, સિટી નવાગામ ઘેડ, જામનગરમાં સ્થિત માલિકી શ્રીમતી શારદાબેન જગદીશ ભોલાણી સાથે બાંધકામ છે. અને મિલકતની ચારે બાજુ :-ઉત્તરે સબ પ્લોટ નં. ૪/૭, દક્ષિણે : સબ પ્લોટ નં. ૪/૫, પુર્વે : ૭.૫ મીટર પહોળો રોડ, પશ્ચિમે : પ્લોઠ

કરે જ ઠારપુ પામ અપ
સરૅનામું
૧. જીતેન્દ્ર જેન્તીભાઈ રાઠોડ
૨. રાઠોડ નિર્મલાબેન જેન્તીભાઈ
હાલ નું સરનામું :- ધનલક્ષ્મી શ્રદ્ધા સોસાયટી, સ્ટ્રીટ નં. ૨
ક્ષાધુવાસવા <b>ણી  રોડ, પોપટપરા પાછળ, રેલનગર, પરિ</b> વા
માર્ટ પાસે, રાજકોટ- ૩૬૦૦૦૧.
અન્ય : જીતેન્દ્ર જેન્તીભાઈ રાઠોડ

فالمرادية عالما عام

નં. ૩૯ અને ૪૦.

બિઝનેસ સરનામું : પ્રજાપતિ મિનરલ વૉટર, ધનલક્ષ્મી શ્રદ્ધા સોસાયટી, સ્ટ્રીટ નં. ૨, સાધુવાસવાણી રોડ, પોપટપરા પાછળ, રેલનગર, પરિવાર માર્ટ પાસે, રાજકોટ-350001.

અન્ય સરનામું : ફ્લેટ નં. ૨૦૧, આશોપાલવ રેસીડેન્સી, રજો માળ, બિલ્ડિંગ નં. એ, ગુલમોહર પ્લાઝા સામે, પેટ્રોલ પંપ પાસે , ૮૦ ફિટ રોડ, રેલનગર, રાજકોટ- ૩૬૦૦૦૧

ઉપરોક્ત નિર્ધારિત વ્યાજ દર,સાથે જણાવેલ નોટીસ પ્રસિધ્ધ અને પ્રાપ્ત થયાના ૬૦ દિવસની અંદર ચુકવી દેવી. ૧૩(૨)નોટિસ તારીખ.૧૬/૧૧/૨૦૨૩.

માંગણા નોટિસ મુજબ

બાકી રકમ**ે** 

રૂા. ૧૮,૦૬,૩૯૧/- (

રૂપિયા અડાર લાખ છ હજાર ત્રણ સો એકાશું પુરા ) જે

૦૬/૧૧/૨૦૨૩ ના રેફ્રેન્સ

ઓફ લોન એકાઉન્ટ નં. SHLHRAJK0001311

## મિલકતનું વિવરણ

રેસીડેન્સીયલ ફ્લેટ નં. ૨૦૧, બિલ્ડ-અપ એરિયા પ૭.પ૦ સ્કેવર મી. જે ૨જા માળે બિલ્ડિંગ આશોપલવ રેસીડેન્સી- એ તરીકે ઓળખાય છે, જગ્યાનો કુલ માપ એરિયા ૨૮૭૫.૦૦ સ્કેવર મી. ઓફ પ્લોટ નં. ૧ અને કૉમન પ્લોટ ઓફ રેવેન્યુ સર્વે નં. ૫૯૮ પૈકી ૪, ફાયનલ પ્લોટ નં ૧૪/૨ ઓફ ટીપીએસ નં. ૨૩ ઓફ રાજકોટ, તેની ચારે બાજુ : પુર્વે :- ફ્લેટ નં. ૨૦૨, પશ્ચિમે ગૉર્ડન, ઉત્તરે :- કવર્ડ પાર્કિંગ, દક્ષિણે : પૈસેજ પછી ફ્લેટ નં. ૨૦૪.

સહી/- અધિકૃત અધિકારી સ્થળ ઃરાજકોટ અને જામનગર શ્રી રામ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ તારીખઃ૦૩.૦૨.૨૦૨૪.